

India conveys its strong concern to Pakistan on the terror attack planned by JeM in the UT of Jammu and Kashmir November 21, 2020

જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં જૈશ એ મોહમ્મદ દ્વારા સુનિયોજિત આતંકવાદી હુમલા સંદર્ભમાં ભારત દ્વારા પાકિસ્તાન સમક્ષ પોતાની ચિંતા રજૂ કરી.

21 નવેમ્બર 2020

19 નવેમ્બર 2020 ના રોજ જમ્મુ અને કાશ્મીર ના નાગ્રોટા વિસ્તારમાં ભારતીય સુરક્ષાદળોએ એક બહુ મોટા આતંકી હુમલા ને પકડી પાડ્યો હતો. શરૂઆતના અહેવાલો એવું દર્શાવે છે કે આ હુમલાખોરો પાકિસ્તાનના જૈશ એ મોહમ્મદ આતંકવાદી સંગઠનના સભ્યો છે કે જે એક એવું આતંકવાદી સંગઠન છે જેના ઉપર યુનાઈટેડ નેશન્સ અને બીજા ઘણા દેશોએ પ્રતિબંધ લાગેલો છે. ભારત સરકારે જેસે મોહમ્મદ દ્વારા ભારત વિરુદ્ધ થઈ રહેલા સતત આતંકવાદી હુમલાઓ બાબતે પોતાની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

ભૂતકાળમાં પણ ફેબ્રુઆરી 2019 માં થયેલ પુલવામાં ના હુમલા સહિત ભારતમાં થયેલા અનેક હુમલાઓમાં જૈશ એ મોહમ્મદનો હાથ રહેલ છે. મોટી માત્રામાં મળી આવેલ શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટક વસ્તુઓ એવું દર્શાવે છે કે જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા ને ડહોળવા માટે અને ખાસ કરીને સ્થાનિક જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી માટે ની ચાલી રહેલી લોકશાહી પ્રક્રિયા ને પણ પાટા પરથી ઉતારી દેવા માટે આ એક બહુ જ મોટા હુમલા માટેનું વિગતવાર આયોજન હતું.

મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ એફર્સ દ્વારા પાકિસ્તાન અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને આવા હુમલાના પ્રયત્નને સખત રીતે વિરોધ નોંધાવ્યો હતો. આ હુમલાને ભારતીય સુરક્ષા દળોની સરળતાને કારણે બનતા અટકાવી શકાયો હતો. એવી માંગણી કરવામાં આવી હતી કે પાકિસ્તાન પોતાની આતંકવાદીઓને અને આતંકવાદી સંગઠનો કે જે તેમના વિસ્તારમાં ઓપરેટ થાય છે અને અન્ય દેશો પર આવા આતંકવાદી વ્યક્તિઓ આક્રમણ કરે છે તેમને સહકાર આપવાની નીતિ ને હવે રોકે અને આવા આતંકવાદી માળખાઓનો નાશ કરે. ભારતે પોતાની બહુ જૂની માંગ દોહરાવી છે કે જેમાં પાકિસ્તાન પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓનું તેમજ દ્વિપક્ષીય પ્રતિબદ્ધતાનું વહન કરે જેમાં ભારત વિરુદ્ધના આતંકવાદને પોતાના અંકુશમાં રહેલ વિસ્તાર માંથી કોઈપણ રીતે ઓપરેટ થવા નહીં દે.

ભારત સરકાર આતંકવાદ સામેની લડતમાં પોતાની રાષ્ટ્રીય સુરક્ષાનું રક્ષણ કરવા માટે જરૂરી એવા તમામ પગલાઓ લેવા માટે કટિબદ્ધ છે.

નવી દિલ્હી.

નવેમ્બર 21, 2020

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.